

DIAMOND POWER INFRASTRUCTURE LIMITED

Corporate Office: A2- 12<sup>th</sup> Floor, "Palladium", Near Orchid Wood, Opp. Divya Bhaskar, Corporate Road, Makarba, Ahmedabad 380 051 Gujarat Website: www.dicabs.com

29th May, 2024

Corporate Relations Department BSE Limited

2<sup>nd</sup> Floor, P.J. Towers Dalal Street, Mumbai – 400 001

Scrip Code: 522163

Re: ISIN-INE989C01020

Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, Plot No. C/1, G- Block,
Bandra Kurla Complex, Bandra (E),

Scrip Symbol: DIACABS

Mumbai - 400 051

Sub.: Submission of Clipping of the Audited Financial Results for the quarter and year ended March 31, 2024, published in Newspaper(s) under Regulation 33 and 47(1)(b) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

In terms of Regulation 33 and 47(1)(b) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Financial Results of the Company have to be published in at least one English language Daily Newspaper and in one Daily Newspaper published in the language of the region, where the registered office of the listed entity is situated within 48 hours of conclusion of the Board Meeting.

Accordingly, please find enclosed herewith the clippings of the extract of Audited Financial Results (Standalone) for the Quarter and Year ended March 31, 2024, published in the following newspapers today, i.e., 29.05.2024 -

- (i) Financial Express (All India Edition);
- (ii) Financial Express (Gujarati Edition)

We request you to kindly take the above information on record for the purpose of dissemination to the Shareholders of the Company. The above information will be available on the website of the company i.e., www.dicabs.com.

Thanking you,

Yours sincerely, For, Diamond Power Infrastructure Limited

TUSHAR J Digitally signed by TUSHAR JLAKHMAPURKAR
LAKHMAPURKAR Date: 2024.05.29 11:55:22 +05'30'

Tushar J. Lakhmapurkar
VP - Legal & Company Secretary

Encl: As above

### FINANCIAL EXPRESS

इंडियन बैंक 🤼 Indian Bank

PORBANDER BRANCH Shop No. 1,2,3, Corss Road Ch Near Friends Petrolium, M.G. Road, Porbander, Gujarat - 360575

Possession Notice (for Immoveable property)

hereas, The undersigned being the Authorized Officer of the Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 23.11.2023 calling upon the borrower Mrs. Jayshreeben Rajubhai Sudra (Borrower & Mortgagor), Mr. Rajesh Shantilal Sudra (Since Deceased) (Borrower & Mortgagor) Represented through his heirs and legal representatives Mrs. Javshreeben Rajubhai Sudra (Wd/o Late Rajesh Shantilal Sudra) Mr. Yash (S/o Late Rajesh Shantilal Sudra) & Mr. Nilesh Shantilal Sudra (Guarantor) with our MG Road Porbandar Branch to repay the amount mentioned in the notice being Rs. 13,10,594.00 (Rupees Thirteen Lakh Ten Thousand Five Hundred and Ninety Four Only) as on 23.11.2023 within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Mortgagor/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower/mortgagor/guarantor and the public in genera that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with Rule 8 & 9 of the said rules on this 28th day of May of the yea Two Thousand Twenty Four.

The Borrower/Mortgagor/Guarantor in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank, MG Road Porbandar Branch for an amount of Rs. 13,10,594.00 (Rupees Thirteen Lakh Ten Thousand Five Hundred and Ninety Four Only) as or 23.11.2023 and future interest & expenses thereon.

"We draw attention to the provisions of Section 13(8) of the SARFAESI Act and the Rules framed there under which deals with your rights of redemption over the securities".

### DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that Pieces and parcel of Residential House at Village Bokhira under Porbandar taluka bearing revenue survey number 43/1 and 73 Paiki plot number 63 its land admeasuring square metres 87.50 and plot number 64 and its land admeasuring square metre 87.50 total land admeasuring 175.00 Paiki part 63 A and its land and measuring 44.375 of Shivalik with existing structure their own and boundary as under At: Bokhira, Tal & Dist: Porbandar, Gujarat 360575. Boundaries: North: Land of plot number 62, South: Land of plot number 63 Paiki part 63-B, East: 6 m compound Road, West: Land of plo number 72

Owner of the property: Mrs. Jayshreeben Rajubhai Sudra & Late Rajesl Shantilal Sudra

Date: 28.05.2024 Place : Porbanda Chief Manager & Authorized Office For Indian Bank इंडियन बैंक 🐼 Indian Bank

Shop No 14-16, Satya Surya Complex, Opp. Sola Bridge, BRTS, Sola Road dabad-380016, Phone-079-27433185

Email: solaroad.ahr [Under Rule (8(1) of Security Interest (Enforcement) Rules, 2002]

Possession Notice (for Immoveable property) Whereas. The undersigned being the Authorized officer of the Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred to him under Section 13(12) (read with Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 14.02.2019 calling upon the Borrower (1) Shree Bhagwati Industries (Proprietorship Firm, Borrower) (2) Mr. Mahendrakumar Patel (Proprietor & Mortgagor) (3) Mrs. Arunaben Mahendrakumar Patel (Guarantor) (4) Mr. Utkarsh Patel (Guarantor) & (5) Mr. Hiteshkumar Patel (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 41,41,514/- (Rupees Forty One Lakh Forty one Thousand Five Hundred Fourteen Only) as on 13.02.2019 within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/Guarantors/Mortgagor having failed to repay the amount notice is hereby given to the Borrowers/Guarantors/Mortgagor and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of Act read with Rule 8 of the said rules or this the 25th Day of May of the year Two Thousand Twenty-Four.

The Borrowers/Guarantors/Mortgagor in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Indian Bank, Sola Road Branch, for an amount Rs. 41,41,514/- (Rupees Forty One Lakh Forty one Thousand Five Hundred

Fourteen Only) as on 13.02.2019 and future Interest & Expenses thereon. The borrower's attention is invited to the provisions Sub-Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

### **Description of Immovable Property**

All that Piece and parcel of the residential Flat No. D-402, on 4th Floor of Devasya Avenue admeasuring 104.92 square meter of super built up area along with undivided portion of the land admeasuring 41.18 square meter lying on Survey no 329/4, TP No. 102 & FP No 23 at Mouje gam Nikol in the registration Sub District of Nikol-12 of District Ahmedabad within state of Guiarat, in the name of Mr. Mahendrakumar Patel, Boundaries of the property are: North: Divyajot Tenement, South: Flat No. D-403, East: Public Road, West: Flat No. D-401

Date: 25.05.2024 Chief Manager & Authorized Office For, Indian Bank Place: Ahmedabad

# **DIAMOND POWER INFRASTRUCTURE LIMITED**

**EXTRACT OF THE AUDITED STANDALONE FINANCIAL RESULTS** FOR THE QUARTER AND YEAR ENDED ON 31<sup>57</sup> MARCH, 2024

(₹ in Lacs

| c          |  |            | Quarter Endec | Year Ended |               |               |
|------------|--|------------|---------------|------------|---------------|---------------|
| Sr.<br>No. | Particulars  | 31.03.2024 | 31.12.2023    | 31.03.2023 | 31.03.2024    | 31.03.2023    |
|            |  | Audited    | Un-audited    | Audited    | Audited       | Audited       |
| 1.         | Total Income from Operations   | 13,498.95  | 6,001.73      | 1,431.69   | 34,412.00     | 1,571.93      |
| 2.         | Net Profit / (Loss) before Tax and exceptional items   | 1,199.42   | (378.89)      | (1,362.24) | 1,720.61      | (4,287.86)    |
| 3.         | Net Profit / (Loss) before Tax after exceptional items   | 1,429.39   | (527.82)      | (1,362.24) | 1,690.37      | (4,287.86)    |
| 4.         | Net Profit / (Loss) after Tax after exceptional items  | 1,441.52   | (527.82)      | (1,362.24) | 1,702.50      | (4,287.86)    |
| 5.         | Total Comprehensive income for the period (comprising profit / (loss) for the period after tax and other comprehensive income after tax) | 1,441.52   | (527.82)      | (1,362.24) | 1,702.50      | (4,287.86)    |
| 6.         | Paid-up Equity Share Capital (Face Value of ₹10/- per share)   | 5,269.71   | 5,269.71      | 5,269.71   | 5,269.71      | 5,269.71      |
| 7.         | Other Equity (excluding Revaluation Reserve)   | -          | -             | _          | (1,02,604.15) | (1,03,258.57) |
| 8.         | Earning per share (of ₹10/- each) (not annualised)   |            |               |            |               |               |
|            | a) Basic (in ₹)  | 2.74       | (1.00)        | (2.59)     | 3.23          | (8.14)        |
| L          | b) Diluted (in ₹)  | 2.74       | (1.00)        | (2.59)     | 3.23          | (8.14)        |

- 1. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company, in their respective meetings held on 27th May, 2024.
- 2. The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the Stock  $Exchanges website, www.nseindia.com \, and \, www.bseindia.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, on \, the \, Company's \, website \, www.dicabs.com \, and \, where \,$

By order of the Board of Directors

Ahmedabad 27<sup>th</sup> May, 2024

For Diamond Power Infrastructure Limited Aditya Nayak - Chief Financial Officer (In-charge) & Whole-time Director DIN: 09572942

Regd. Office: Phase II, Village Vadadala, Taluka - Savli, Vadodara - 391520 E-mail: tushar.lakhmapurkar@dicabs.com | www.dicabs.com | CIN:L31300GJ1992PLC018198

### **SHALBY LIMITED**

Regd. Office: Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad 380015, Gujarat

• Tel: 079 40203000 Fax: 079 40203109

E-mail: companysecretary@shalby.in website: www.shalby.org CIN: L85110GJ2004PLC044667

\*Passion \*\* Compassion \*\* Innovation \*

Dividend recommended: ₹ 1.20 per share

"Legacy of Growth Continues"

### **EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024**

( ₹ in million, except per share data)

|     |  |                                 | Standalone                   |  | Conso            | 2024 2023<br>Idited Audited<br>337.49 8,049.21<br>281.90 1,020.43 |  |  |  |
|-----|--|---------------------------------|------------------------------|--|------------------|---|--|--|--|
| Sr. | Posts to a   |                                 | Standarone                   |  | Year e           | ended   |  |  |  |
| No. | Particulars  | Quarter Ended<br>March 31, 2024 | Year Ended<br>March 31, 2024 | Corresponding<br>Quarter Ended<br>March 31, 2023 | March 31<br>2024 |   |  |  |  |
|     |  | Audited                         | Audited                      | Audited  | Audited          | Audited   |  |  |  |
| 1   | Total income from Operations   | 2,063.23                        | 8,296.83                     | 1,774.14   | 9,337.49         | 8,049.21  |  |  |  |
| 2   | Net Profit / (Loss) for the period<br>(before Tax, Exceptional and/ or<br>Extraordinary items)   | 325.16                          | 1,583.11                     | 264.93   | 1,281.90         | 1,020.43  |  |  |  |
| 3   | Net Profit / (Loss) for the period before tax<br>(after Exceptional and/or<br>Extraordinary items  | 325.16                          | 1,583.11                     | 264.93   | 1,281.90         | 1,020.43  |  |  |  |
| 4   | Net Profit / (Loss) for the period after tax<br>(after Exceptional and/or<br>Extraordinary items)  | 225.59                          | 1,038.45                     | 183.54   | 834.97           | 676.77  |  |  |  |
| 5   | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 225.97                          | 1,040.76                     | 188.32   | 841.40           | 688.02  |  |  |  |
| 6   | Paid-up Equity Share Capital<br>(Face Value ₹ 10/- each)   | 1,074.13                        | 1,074.13                     | 1,073.10   | 1,074.13         | 1,073.10  |  |  |  |
| 7   | Reserves (excluding Revaluation<br>Reserve) as shown in Audited Balance\<br>Sheet of previous year)  | -                               | 9,547.63                     | -  | 8,929.61         | 8,203.76  |  |  |  |
| 8   | Earnings Per Share (Face Value of ₹ 10/- each)<br>(I) Basic EPS<br>(II) Diluted EPS  | 2.10<br>2.10                    | 9.67<br>9.67                 | 1.71<br>1.70                                     | 7.78<br>7.77     | 6.31<br>6.27  |  |  |  |

- 1. The above is an extract of the detailed format of audited financial results for the quarter and year ended March 31, 2024, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI LODR 2015). The full format of Standalone and Consolidated Financial Results for the quarter and year ended March 31, 2024 are available on the websites of the Stock Exchanges at www.nseindia.com, www.bseindia.com and on the Company's website www.shalby.org
- 2. The Board of Directors have recommended final dividend of ₹1.20 (Rupees One and Twenty Paisa Only) per equity share of ₹10/- each, subject to approval of shareholders.
- 3. The above financial results of the Company were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on May 28, 2024. The Statutory Auditors have expressed unmodified audit opinion on the aforesaid results.

For and on behalf of Board of Directors Dr. Vikram Shah

Place: Ahmedabad **Chairman and Managing Director** Date: May 28, 2024

DIN: 00011653 Place : Surat



CIN: L24231GJ1992PLC017315
Registered Office: Plot No. 1504/1505/1506/1 GIDC, Phase-III Vapi Valsad-396195, Gujarat, India.
Corporate Office:2nd Floor, A Wing, Fortune Avirahi, Jain Derasar Road, Borivali (West), Mumbai-

|            |   |              | EAR ENDED ON MARCH 31, 2024<br>STANDALONE |              |                |                |            | (₹in Crores except per share data<br>CONSOLIDATED |              |              |                |  |
|------------|---|--------------|---|--------------|----------------|----------------|------------|---|--------------|--------------|----------------|--|
| <b>S</b> . | Particulars   |              | Quarter                                   |              |                | Ended          |            | Quarter   |              |              | Ended          |  |
| Ю.         | Particulars   |              |   | 31.03.2023   |                |                |            |   |              |              |                |  |
|            |   | (Reviewed)   | (Reviewed)                                | (Reviewed)   | (Audited)      | (Audited)      | (Reviewed) | (Reviewed)  | (Reviewed)   | (Audited)    | (Audited)      |  |
| 1.         | Total Income from operations  | 261.29       | 301.70                                    | 258.90       | 1274.75        | 1324.38        | 257.91     | 299.66  | 260.18       | 1257.07      | 1318.82        |  |
| 2          | Net Profit/(loss) for the Period<br>(before tax, exceptional items)     | 18.31        | 26.07                                     | 18.15        | 90.39          | 144.14         | 3.68       | 16.92   | 14.62        | 52.24        | 137.58         |  |
| 3          | Exceptional items (expenses)  | -            |   | -            | -              |                |            |   | -            |              |                |  |
| 4          | Net profit/(loss)for the period before<br>tax (after exceptional items) | 18.31        | 26.07                                     | 18.15        | 90.39          | 144.14         | 3.68       | 16.92   | 14.62        | 52.24        | 137.58         |  |
| 5          | Net profit/(loss) for the period after<br>tax (after exceptional items) | 13.11        | 19.22                                     | 14.33        | 66.35          | 110.11         | (0.73)     | 13.92   | 11.15        | 34.50        | 104.37         |  |
| 6          | Total comprehensive income/(loss)<br>for the period                     | 12.95        | 19.26                                     | 14.07        | 66.33          | 110.30         | (0.87)     | 13.98   | 10.89        | 34.50        | 104.56         |  |
| 7          | Equity share capital<br>(face value Rs. 10/- each)                      | 40.01        | 40.01                                     | 40.01        | 40.01          | 40.01          | 40.01      | 40.01   | 40.01        | 40.01        | 40.01          |  |
| 8          | Other Equity  | -            | -   | -            | 837.45         | 776.10         | -          | -   | -            | 803.05       | 770.36         |  |
| 9          | Earnings per share-<br>(face value Rs. 10/- each)                       |              |   |              |                |                |            |   |              |              |                |  |
|            | Basic (in Rs.)<br>Diluted (in Rs.)                                      | 3.28<br>3.28 | 4.80<br>4.80                              | 3.58<br>3.58 | 16.58<br>16.58 | 27.52<br>27.52 | (0.09)     | 3.48<br>3.48                                      | 2.79<br>2.79 | 8.72<br>8.72 | 26.08<br>26.08 |  |

The above is an extract of the detailed format of financial results filed by the company with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations an Disclosure Requirements) Regulation, 2015. The Full format of these results is available on the stock exchanges website i.e. www.bseindia.com & www.nseindia.com

also on the company's website www.heranba.co.in. The above results have been reviewed by the Audit Committee and thereafter approved by the board of directors in their respective meetings held on May 27, 2024. The previous financial period figures have been regrouped/rearranged/restated wherever considered necessary.

By Order of the Board of the Boar

The previous financial period figures have been regrouped/rearranged/restated wherever considered necessary.

For Heranba Industries Limited

Raghuram K. Shetty

DIN: 00038703

Date: May 27, 2024

AU SMALL FINANCE BANK LIMITED (A Scheduled Commercial Bank) Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001 (CIN:L36911RJ1996PLC011381)

APPENDIX IV [SEE RULE 8(I)] POSSESSION NOTICE Whereas, The undersigned being the Authorized Officer of the AU Small Finance Bank Limited (A Scheduled Commercial Bank) under the

Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act, 2002 (54 of 2002)] and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice on the date as mentioned below calling upon the borrowers to repay the amount mentioned in the said notice within  $60\,\mathrm{days}$  from the date of receipt of the said notice as per the details given in below table:

| Name of Borrower/Co-Borrower/<br>Mortgagor/Guarantor/Loan A/c No.   | 13(2) Notice<br>Date & Amount   | Description of Mortgaged Property  | Date of<br>Possession Taken |
|---|---|--|-----------------------------|
| (Loan A/C No.) L9001060722777334,<br>Anwarbhai Saiyad (Borrower), Saiyad<br>Sadatbhai (Co-Borrower), Smt.Saiyad<br>Hamidaben Jakirhushen (Co-<br>Borrower) Yunusali Saiyad (Co-<br>Borrower) Smt.Saiyad Senajben<br>Hashanali (Co-Borrower) | 14-Sep-23 ₹ 11,04,253/-<br>Rs. Eleven Lac Four<br>Thousand Two Hundred<br>Fifty-Three Only as on<br>12-Sep-23   | All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Property Situated At -Rural Rs No 730 , Sr No 94 84 85, Plot No 98, Vill- Karjan, Dist- Vadodara , Gujarat. Admeasuring 167 Sqyds East: Open Space Of Plot No. 105 And 106 West: Plot No.97 North: Raod South: Plot No. 99  | 25-May-24                   |
| (Loan A/C No.) L9001060113778557,<br>Yogesh Nihal Singh Katewa (Borrower)<br>, Premlata Yogesh Katewa (Co-<br>Borrower)   | 17-Nov-23 ₹ 15,91,921/-<br>Rs. Fifteen Lac Ninety-One<br>Thousand Nine Hundred<br>Twenty-One Only as on<br>10-Nov-23  | All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures (Property 1) Property Situated At-Flat No. 101, Ground Floor, Block No. B-19, Green City, Sub Plot No. 04, Village- Ranakpur, Tehsil- Kalol, Distt- Gandhinagar , Gujrat Admeasuring 33.57 Sq. Mtr. East: Open Land West: Parking Area North: Flat No. B/20/102 South: Flat No. B/19/102 (Property 2) Property Situated At- Flat No. 102, First Floor, Block No. B-19, Green City, Sub Plot No. 04, Village- Ranakpur, Tehsil- Kalol, Distt-Gandhinagar , Gujarat. Admeasuring 33.57 Sq. Mtr. East: Open Land, West: Parking Area, North: Flat No. B/20/102, South: Flat No. B/19/102 | 25-May-24                   |
| (Loan A/C No.) L9001060825967983<br>& L9001060121475791, Mer Vanraj<br>Mafabhai (Borrower) , Mafabhai<br>Haribhai Mer (Co-Borrower),<br>Smt.Vijuben Vanrajbhai Mer (Co-<br>Borrower)  | 15-Dec-23 ₹ 3,36,820/- Rs. Three Lac Thirty-Six Thousand Eight Hundred Twenty Only as on 13-Dec-23 & 12-Jan-24 ₹ 4,29,844/- Rs. Four Lac Twenty-Nine Thousand Eight Hundred Forty-Four Only as on 12-Jan-24 | All That Part And Parcel Of Residential/Commercial Property Land /<br>Building / Structure And Fixtures Property Situated At- Survey No 164<br>165/1 And 165/2 Paiki, Plot No 1018, Shri Aksharpark Co Op So Ltd,<br>Village- Chitra ,Taluka And District Bhavnagar, Gujarat <b>Admeasuring</b><br><b>89.91 Sq.Mtr</b>   | 23-May-24                   |
| (Loan A/C No.) L9001061121372285 & L9001060116672125, Bhagabhai Govindbhai Parmar (Borrower) , Smt.Parmar Lili Ben Bhagabhai (Co-Borrower)  | 08-Feb-24 ₹ 4,08,000/- Rs. Four Lac Eight Thousand Only & ₹ 57,48,088/- Rs. Fifty-Seven Lac Forty- Eight Thousand Eighty- Eight Only as on 06-Feb-24  | All That Part And Parcel Of Residential/Commercial Property Land /<br>Building / Structure And Fixtures Property Situated At Plot No 7 , 8 ,<br>11, 12 , Rs No 60 , Gram Panchayat Mouza -Hindorna , Tal- Rajula ,<br>Dist - Amreli , Gujarat Admeasuring 1052.49 Sq.Mtr   | 24-May-24                   |
| (Loan A/C No.) L9001060700412700,<br>Rishiraj Jagdishchandra Trivedi<br>(Borrower), Jagdishchandra Himmatlal<br>Trivedi (Co-Borrower), Ashaben<br>Jagdishchandra Trivedi (Co-Borrower)  | Forty-Eight only<br>as on 15-Mar-22   | All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Property Situated At Plot No.13 Paiki, Middle Land, Revenue Survey No. 416/2 paiki/1, Batod, Gujarat Admeasuring 41.60 Sq. Mtr. (Total admeasuring 104 Sq. Mtr.) East: Plot No. 14, West: Road, North: Plot No. 14, South: Plot No. 12 is hereby given to the borrower and the public in general that the und-  |                             |

possession of the property described herein above mentioned table in exercise of powers conferred on him/her under section 13(4) of the said [Act 2002] read with Rule 8 of the said rule on the date mentioned in the above table.

"The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets." The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be of the AU Small Finan Bank Limited (A Scheduled Commercial Bank) for the above table

Date : 28/05/2024 Authorised Officer AU Small Finance Bank Limited Place : Ahmedabad

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED Narayan Chambers, 2th Floor, 8th. Patang Hotel, Ashram Road, Ahmedabad-380099. Contact: 079-41106500 /733

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY) Rule 8(1) of Security Interest (Enforcement Rules 2002)


Whereas the undersigned being the authorized officer of the MAS Rural Housing & Mortgage Finance Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated as on below details calling upon the Borrower/Co-borrower/Guarantor to repay the amount mentioned in the notice being within Sixty Days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrower/Guarantor and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said [Act] read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002, as on below details.

The Borrower/Co-borrower/Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the Property will be subject to the charge of the MAS Rural Housing & Mortgage Finance Ltd. as on below details and interest thereon.

| The Borrower/Co-borrower/Guaranto redeem the secured assets.                    | r attention is invited to provisions of sub-section (8) of section 13   | of the Act, in resp                | ect of time available, to  |
|---|---|------------------------------------|--|
| Borrower & Co-Borrower,<br>Guarantor Name                                       | Description Of The<br>Immovable Property  | Loan A/C No<br>Date of Possesion   | Date & Amount of<br>Demand Notice  |
| ANOOP RAKESH SHUKLA<br>(APPLICANT)<br>KANCHAN ANOOP SHUKLA<br>(CO-APPLICANT)    | ALL THAT PIECE AND PARCEL OF THE PROPERTY BEARING PLOT NO.48, ADMEASURING 40.19 SQ. MTRS. ALONG WITH UNDIVIDED SHARE 27.85 SQ. MTRS. IN ROAD & COP AND CONSTRUCTION THEREON IN SCHEME KNOWN AS "GOVARDHANNATH RESIDENCY VIBHAG-2" SITUATED AT BLOCK NO.355, 357, 358, AFTER AMALGAMATION NEW BLOCK NO.355, AFTER KJP 355/48, TOTAL LAND 12950 SQ. MTRS. AT VILLAGE MOTA, TA. BARDOLI, IN THE REGISTRATION DISTRICT & SUB DISTRICT OF SURAT, GUJARAT.  | Loan A/C No.<br>5868<br>26-05-2024 | Rs.7,70,298.00 in<br>Words Seven Lakh<br>Seventy Thousand<br>Two Hundred Ninety<br>Eight Rupees Only<br>as on Date<br>16.06.2023.          |
| RAMSUMER BABULAL RAVAT<br>(APPLICANT)<br>KUSUM RAMSUMER RAVAT<br>(CO-APPLICANT) | ALL THAT PIECE AND PARCEL OF THE PROPERTY BEARING PLOT NO.21, ADMEASURING 74.91 SQ. MTRS. (AS PER REVENUE RECORD OF 7/12 OLD BLOCK NO.112/21 & NEW BLOCK NO.441) ADMEASURING 74.00 SQ. MTRS. ALONGWITH PROPORTIONATE UNDIVIDED SHARE IN ROAD ADMEASURING 43.69 SQ. MTRS. AND IN C.O.P2 ADMEASURING 11.95 SQ. MTRS. & CONSTRUCTION THEREON IN SCHEME KNOWN AS "ASTHVINAYAK METROCITY" SITUATED AT BLOCK NO.112 & REVENUE SURVEY NO.218/1, AT MOUJE LINDIYAD, TA. MANGROL, IN THE REGISTRATION DISTRICT & SUB DISTRICT OF SURAT, GUJARAT.         | Loan A/C No.<br>6387<br>26-05-2024 | Rs.14,23,444.00 in<br>Words Fourteen Lakh<br>Twenty Three<br>Thousand Four<br>Hundred Fourty<br>Four Rupees Only as<br>on Date 16.06.2023. |
| JAYESH GOVINDA BHAGVAT<br>(APPLICANT)<br>MAMTA JAYESH BHAGVAT<br>(CO-APPLICANT) | ALL THAT PIECE AND PARCEL OF THE PROPERTY BEARING FLAT NO.502, FIFTH FLOOR, ADMEASURING 31.49 SQ. MTRS. (BUILTUP AREA) & 52.51 SQ. MTRS. (SUPER BUILTUP AREA) ALONG WITH UNDIVIDED SHARE OF GROUND LAND ADMEASURING 7.72 SQ. MTRS. IN SCHEME KNOWN AS "SARITA PALACE" SITUATED AT BLOCK NO.29, ADMEASURING 26042 SQ. MTRS. DEVELOPED AS "ARADHANA PALACE" PAIKEE, PLOT NOS.178, 179, 180, TOTAL ADMEASURING 168.91 SQ. MTRS. RESIDENTIAL N.A. LAND PAIKEE, AT VILLAGE JOLWA, TA. PALSANA, IN THE REGISTRATION DISTRICT & SUB DISTRICT OF SURAT, | Loan A/C No.<br>6773<br>26-05-2024 | Rs.7,41,359.00 in<br>Words Seven Lakh<br>Fourty One Thousand<br>Three Hundred Fifty<br>Nine Rupees Only<br>as on Date 16.06.2023.          |

GUJARAT. Authorized Officer, Mr. Bharat J. Bhatt (M.) 9714199018 Date: 29-05-2024 For, MAS Rural Housing & Mortgage Finance Ltd.





# રૂપિયો યુએસ ડોલર વિરુદ્ધ પાંચ પૈસા સંકડાઇ ૮૩.૧૮ બંધ રહ્યો

પીટીઆઇ

મુંબઇ, તા. ૨૮

તારીખ : ૨૯-૦૫-૨૦૨૪

(પ્રોવિઝનલ) યુએસ ડોલર સામે પિયો ટૂંકી રેન્જમાં કોન્સોલિડેટેડ ઘટાડા સામે રક્ષણ મળી રહે છે. સેટલ થયો હતો કેમ કે ઘરેલું થતો રહ્યો છે કારણ કે ક્રૂડ ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ મંગળવારે રૂપિયાએ યુએસના શેરોમાં નકારાત્મક વલણ રહ્યું હતું ઓઇલનાભાવઊંચા રહ્યા છે જેની બજાર ખાતે, સ્થાનિક યુનિટમાં ગ્રીનબેક સામે શરૂઆતી લાભ અને નીચા ભાવે ડોલરમાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ટૂંકી રેન્જમાં કામકાજ થયા હતા. ્રામાવી દીધો હતો અને પાંચ આયાતકારોની માંગ રહી હતી. અસર રહી છે, જ્યારે યુએસ રૂપિયામાં ડોલર સામે ૮૩.૧૪ ઘટાડે ૮૩.૧૮ ફોરેક્સના ટ્રેડર્સે જણાવ્યું હતું કે રૂ ડોલરમાં ઘટાડાથી રૂપિયાને વધુ ભાવે કામકાજની શરૂઆત થઇ.

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED Narayan Chambers, 2th Floor, B/h. Patang Hotel, Ashram Road, Ahmedabad-380009. Contact : 079-41106500 / 733


**ક**બજા नोटिस (सिड्योरिटी छन्टरेस्ट (सेन्ड्रोर्समेन्ट) नियमो २००२ना नियम ८(९))(स्थापर मिसडत माटे-समूख मिसडत माटे)

આથી, નીચે સહી કરનાર તે **માસ ૩૨લ હાઉસિંગ અને મોર્ગેજ કાઇનાન્સ લિમિટેડ** ના ઓથોરાઈઝડ અધિકારીએ ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨નો ઓર્ડર ૫૪) અને કાયદા તળેની સેક્શન ૧૩ (૧૨) સાથે ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ -૩ મુજબ મળેલ પાવર્સ મુજબ નીચે મુજબના કરજદાર / સહ-કરજદાર / જામીનદારને નીચે મુજબના રોજ નોટિસ આપેલી અને તે નોટીસમાં જણાવેલ ૨કમ નોટીસ મળ્યાથી દિન ૬૦માં ચુંકવવા જણાવેલ.

કરજદાર આ રકમ ચુકવવામાં અસમર્થ રહેલ છે, જેથી સદર અરજદાર / સહ-અરજદાર / જામીનદાર અને જાહેર જનતાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે સામાન્ય રીતે મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથે થતા કોઈ પણ સોદાની નીચે મુજબ લેણી થતા તેની પરના વ્યાજ ની ૨કમ માટે **માસ રૂરલ હાઉસિંગ અને મોર્ગેજ ફાઇનાન્સ લિ.**નાચાર્જમાં ગણાશે. અમો નીચે સહી કરનારે નીચે દર્શાવેલી મિલ્કતોનો **નીચે મુજબ ના રોજ ભોતિક કબજો** સેક્શન ૧ ૩ના સબસેક્શન (૪) સાથે રૂલ- ૮ તળે મળેલ સત્તાની રૂએ મેળવેલ છે.

અરજદાર/સહ અરજદાર / જામીનદાર નું ધ્યાન દોરવામાં આવે છે કે, સદર કાયદાની કલમ ૧૩ની સબ-સેક્શન (૮) મુજબ સદર મિલ્કતની પુનઃ પ્રાપ્તિ માટે

| અરજદાર/સહ-અરજદાર/<br>જામીનદારનાં નામ                                    | સ્થાવર મિલકતનું વર્ણન   | લોન એકાઉન્ટ નં<br>પઝેશનની તારીખ          | બાકી નીકળતી લેણી રકમ<br>(જે ડિમાન્ડ નોટિસમાં જણાવ્યા પ્રમાણે)  |
|---|---|--|--|
| અર્જા કોક્લા<br>(સહ-અરહાર)<br>કંચન અર્જા શેક્લા<br>(સહ-અરહાર)           | જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ સબ - ડિસ્ટ્રીકટ સુરત ખાતે આવેલ<br>મોજે ગામ મોટા, તાલુકો બારડોલી, જિલ્લો સુરત ખાતે આવેલ<br>બ્લોક નં. ૩૫૫, ૩૫૭, ૩૫૮, અમાલગામેશન પછી નવો<br>બ્લોક નં. ૩૫૫, કેજેપી પછી ૩૫૫/૪૮ કે જેનું કુલ ક્ષેત્રફળ<br>૧૨૯૫૦ ચો.મી. તેના પર આવેલ સ્કીમ કે જે ''ગોરધનનાથ<br>રેસીડેન્સી વિભાગ-૨''ના નામથી ઓળખાય છે. તેના પ્લોટ નં.<br>૪૮ કે જેનું ક્ષેત્રફળ ૪૦.૧૯ ચો.મી. રોડ અને સીઓપી સહિત<br>બાંધકામવાળી તમામ મિલકત.   | લોન એકાઉન્ટ<br>નંબર : ૫૮૬૮<br>૨૬-૦૫-૨૦૨૪ | તા.૧૬-૦૬-૨૦૨૩ના રોજ બાકી<br><b>રૂા.७,७૦,૨૯૮.૦૦</b> (અંકે રૂપિયા<br>સાત લાખ સિત્તેર હજાર બસો<br>અકાશુાં પુરા)       |
| રામસુમેર બાબુલાલ રાવત<br>(અરજદાર)<br>કુસુમ રામસુમેર રાવત<br>(સહ-અરજદાર) | જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ સબ - ડિસ્ટ્રીકટ સુરત ખાતે આવેલ<br>મોજે લીનડીયાડ, તાલુકો માંગરોલ, જિલ્લો સુરત ખાતે આવેલ<br>બ્લોક નં. ૧૧૨ અને રેવન્યુ સર્વે નં. ૨૧૮/૧ તેના પર આવેલ<br>સ્કીમ કે જે ''અષ્ટવિનાયક મેટ્રોસીટી''ના નામથી ઓળખાય છે.<br>તેના પ્લોટ નં. ૨૧ કે જેનું ક્ષેત્રફળ ૭૪.૯૧ચો.મી. (રેવન્યુ<br>રોકોર્ડ મુજબ ૭/૧૨ જુનો બ્લોક નં. ૧૧૨/૨૧ અને નવો બ્લોક<br>નં. ૪૪૧) કે જેનું ક્ષેત્રફળ ૭૪.૦૦ ચો.મી. ઉપરાંત સમાન<br>વણવહેંચાયેલ હિસ્સા રોડ ક્ષેત્રફળ ૪૩.૬૯ ચો.મી. અને<br>સી.ઓ.પી૨ ક્ષેત્રફળ ૧૧.૯૫ ચો.મી. છે. તેવી બાંધકામ<br>સહિતની તમામ મિલકત.  | નંબર : કરવ<br>સ્ક-૦૫-૨૦૨૪                | તા. ૧૬-૦૬-૨૦૨૩ના રોજ બાકી<br><b>રૂા.૧૪,૨૩,૪૪૪.૦૦</b> (અંકે રૂપિયા<br>ચૌદ લાખ ત્રેવીસ હજાર ચારસો<br>ચુંબાલીસા પુરા) |
| જચેશ ગોવિંદા ભાગવત<br>(અરજદાર)<br>મમતા જચેશ ભાગવત<br>(સહ-અરજદાર)        | જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ સબ - ડિસ્ટ્રીકટ સુરત ખાતે આવેલ<br>મોજે ગામ જોલવા, તાલુકો પલસાણા, જિલ્લો સુરત ખાતે આવેલ<br>બ્લોક નં. ૨૯ કે જેનું ક્ષેત્રફળ ૨૬૦૪૨ ચો.મી. પર ડેવલોપ<br>કરેલ ''અરાધના પેલેસ'' પૈકી, પ્લોક નં. ૧૭૮, ૧૭૯, ૧૮૦<br>કુલ ક્ષેત્રફળ ૧૬૮.૯૧ ચો.મી. રહેણાંક બીનખેતીની જમીન<br>પૈકી પર આવેલ સ્કીમ કે જે ''સરીતા પેલેસ''ના નામથી<br>ઓળખાય છે. તેના ફલેટ નં. ૫૦૨, પાંચમા માળે કે જેનું ક્ષેત્રફળ<br>૩૧.૪૯ ચો.મી. (બિલ્ટઅપ એરીયા) અને પર.૫૧ ચો.મી.<br>(સુપર બિલ્ટઅપ એરીયા) ઉપરાંત વણવહેંચાયેલ હિસ્સા ગ્રાઉન્ડ<br>જમીન ક્ષેત્રફળ ૭.૭૨ ચો.મી. છે. તેવી બાંધકામ સહિતની<br>તમામ મિલકત. | નંબર : ૬७७૩<br>૨૬-૦૫-૨૦૨૪                | તા. ૧૬-૦૬-૨૦૨૩ના રોજ બાકી<br><b>રૂા.७,૪૧,૩૫૯.૦૦</b> (અંકે રૂપિયા<br>સાત લાખ એકતાલીસ હજાર<br>ત્રણસો ઓગણસાઈઠનવ પુરા) |



## FOR THE QUARTER & YEAR ENDED 31<sup>ST</sup> MARCH, 2024

(₹ In million)

અધિકૃત અધિકારી શ્રી ભરત જે. ભટ્ટ (મો.) ૯૭૧૪૧૯૯૦૧૮

| Sr.<br>No. | Particulars   | Quarter<br>ended<br>31-03-2024 | Quarter<br>ended<br>31-12-2023 | Quarter<br>ended<br>31-03-2023 | Year<br>ended<br>31-03-2024 | Year<br>ended<br>31-03-2023 |
|------------|---|--------------------------------|--------------------------------|--------------------------------|-----------------------------|-----------------------------|
|            |   | Audited                        | Unaudited                      | Audited                        | Audited                     | Audited                     |
| 1          | Total Revenue from Operations   | 1,581.80                       | 1,400.74                       | 1,422.70                       | 5,703.70                    | 4,609.38                    |
| 2          | Net Profit/(Loss) for the period (before Tax, Exceptional)  | 531.75                         | 400.99                         | 532.89                         | 1,656.90                    | 1,234.87                    |
| 3          | Net Profit/(Loss) for the period before Tax (after Exceptional )  | 531.75                         | 400.99                         | 532.89                         | 1,656.90                    | 1,234.87                    |
| 4          | Net Profit/(Loss) for the period after Tax (after Exceptional)  | 369.32                         | 297.87                         | 382.29                         | 1,191.14                    | 898.57                      |
| 5          | Total Comprehensive Income for the period (comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax) | 369.66                         | 300.57                         | 377.63                         | 1,207.37                    | 886.00                      |
| 6          | Equity Share Capital  | 160.97                         | 160.97                         | 160.97                         | 160.97                      | 160.97                      |
| 7          | Other Equity  | 7992.70                        | 7,628.55                       | 6,833.62                       | 7992.70                     | 6,833.62                    |
| 8          | Earning per share (of ₹ 2/- each)<br>(not annualized)   |                                |                                |                                |                             |                             |
|            | 1. Basic  | 4.59                           | 3.77                           | 4.75                           | 14.80                       | 11.16                       |
|            | 2. Diluted  | 4.59                           | 3.77                           | 4.75                           | 14.80                       | 11.16                       |

Place: Mumbai

Date: 28-05-2024

- a) The Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 28th May, 2024. The Auditors of the Company have carried out Audit of the Audited Financial Results for the Quarter & Year Ended 31.03.2024.
- b) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly and yearly Financial Results are available on the websites (www.bseindia.com), (www.nseindia.com) and Company's website (www.supriyalifescience.com)

c) The Board of Directors at their meeting dated 28th May, 2024 have recommended final dividend of INR 0.80/- per equity share

For Supriya Lifescience Limited Dr. Satish Waman Wagh

Chairman & Managing Director

DIN: 01456982

SUPRIYA LIFESCIENCE LIMITED

CIN: L51900MH2008PLC180452 207/208, Udyog Bhavan, Sonawala Road, Goregaon (East), Mumbai - 400063. Tel. No.: +91 22 40332727; E-mail: cs@supriyalifescience.com; Website: www.supriyalifescience.com

# **DIAMOND POWER INFRASTRUCTURE LIMITED**

**EXTRACT OF THE AUDITED STANDALONE FINANCIAL RESULTS** 

|  |  | O   |   |  |   |
|--|--|---|---|--|---|
|  |  | Quarter Endec   | Year Ended  |  |   |
| Particulars  | 31.03.2024   | 31.12.2023  | 31.03.2023  | 31.03.2024   | 31.03.2023  |
|  | Audited  | Un-audited  | Audited   | Audited  | Audited   |
| Total Income from Operations   | 13,498.95  | 6,001.73  | 1,431.69  | 34,412.00  | 1,571.93  |
| Net Profit / (Loss) before Tax and exceptional items   | 1,199.42   | (378.89)  | (1,362.24)  | 1,720.61   | (4,287.86)  |
| Net Profit / (Loss) before Tax after exceptional items   | 1,429.39   | (527.82)  | (1,362.24)  | 1,690.37   | (4,287.86)  |
| Net Profit / (Loss) after Tax after exceptional items  | 1,441.52   | (527.82)  | (1,362.24)  | 1,702.50   | (4,287.86)  |
| Total Comprehensive income for the period (comprising profit / (loss) for the period after tax and other comprehensive income after tax) | 1,441.52   | (527.82)  | (1,362.24)  | 1,702.50   | (4,287.86)  |
| Paid-up Equity Share Capital (Face Value of ₹10/- per share)   | 5,269.71   | 5,269.71  | 5,269.71  | 5,269.71   | 5,269.71  |
| Other Equity (excluding Revaluation Reserve)   | _  | -   | -   | (1,02,604.15)  | (1,03,258.57)   |
| Earning per share (of ₹10/- each) (not annualised)   |  |   |   |  |   |
| a) Basic (in ₹)  | 2.74   | (1.00)  | (2.59)  | 3.23   | (8.14)  |
| b) Diluted (in ₹)  | 2.74   | (1.00)  | (2.59)  | 3.23   | (8.14)  |
|  | Total Income from Operations  Net Profit / (Loss) before Tax and exceptional items  Net Profit / (Loss) before Tax after exceptional items  Net Profit / (Loss) after Tax after exceptional items  Total Comprehensive income for the period (comprising profit / (loss) for the period after tax and other comprehensive income after tax)  Paid-up Equity Share Capital (Face Value of ₹10/- per share)  Other Equity (excluding Revaluation Reserve)  Earning per share (of ₹10/- each) (not annualised)  a) Basic (in ₹) | Audited         Total Income from Operations       13,498.95         Net Profit / (Loss) before Tax and exceptional items       1,199.42         Net Profit / (Loss) before Tax after exceptional items       1,429.39         Net Profit / (Loss) after Tax after exceptional items       1,441.52         Total Comprehensive income for the period (comprising profit / (loss) for the period after tax and other comprehensive income after tax)       1,441.52         Paid-up Equity Share Capital (Face Value of ₹10/- per share)       5,269.71         Other Equity (excluding Revaluation Reserve)       —         Earning per share (of ₹10/- each) (not annualised)       a) Basic (in ₹) | Audited     Un-audited       Total Income from Operations     13,498.95     6,001.73       Net Profit / (Loss) before Tax and exceptional items     1,199.42     (378.89)       Net Profit / (Loss) before Tax after exceptional items     1,429.39     (527.82)       Net Profit / (Loss) after Tax after exceptional items     1,441.52     (527.82)       Total Comprehensive income for the period (comprising profit / (loss) for the period after tax and other comprehensive income after tax)     1,441.52     (527.82)       Paid-up Equity Share Capital (Face Value of ₹10/- per share)     5,269.71     5,269.71     5,269.71       Other Equity (excluding Revaluation Reserve)     —     —     —       Earning per share (of ₹10/- each) (not annualised)     a) Basic (in ₹)     2.74     (1.00) | AuditedUn-auditedAuditedTotal Income from Operations13,498.956,001.731,431.69Net Profit / (Loss) before Tax and exceptional items1,199.42(378.89)(1,362.24)Net Profit / (Loss) before Tax after exceptional items1,429.39(527.82)(1,362.24)Net Profit / (Loss) after Tax after exceptional items1,441.52(527.82)(1,362.24)Total Comprehensive income for the period (comprising profit / (loss) for the period after tax and other comprehensive income after tax)1,441.52(527.82)(1,362.24)Paid-up Equity Share Capital (Face Value of ₹10/- per share)5,269.715,269.715,269.71Other Equity (excluding Revaluation Reserve)Earning per share (of ₹10/- each) (not annualised)2.74(1.00)(2.59) | Audited         Un-audited         Audited         Audited           Total Income from Operations         13,498.95         6,001.73         1,431.69         34,412.00           Net Profit / (Loss) before Tax and exceptional items         1,199.42         (378.89)         (1,362.24)         1,720.61           Net Profit / (Loss) before Tax after exceptional items         1,429.39         (527.82)         (1,362.24)         1,690.37           Net Profit / (Loss) after Tax after exceptional items         1,441.52         (527.82)         (1,362.24)         1,702.50           Total Comprehensive income for the period (comprising profit / (loss) for the period after tax and other comprehensive income after tax)         1,441.52         (527.82)         (1,362.24)         1,702.50           Paid-up Equity Share Capital (Face Value of ₹10/- per share)         5,269.71         5,269.71         5,269.71         5,269.71           Other Equity (excluding Revaluation Reserve)         -         -         -         (1,02,604.15)           Earning per share (of ₹10/- each) (not annualised)         2.74         (1.00)         (2.59)         3.23 |

- 1. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company, in thei respective meetings held on 27th May, 2024.
- 2. The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI  $(Listing\ obligations\ and\ Disclosure\ Requirements)\ Regulations,\ 2015.\ The\ full\ format\ of\ the\ Audited\ Financial\ Results\ are\ available\ on\ the\ Stockson and\ Disclosure\ Requirements)$ Exchanges website, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.dicabs.com

By order of the Board of Directors

Ahmedabad 27th May, 2024

For Diamond Power Infrastructure Limited Aditya Nayak - Chief Financial Officer (In-charge) & Whole-time Director

Regd. Office: Phase II, Village Vadadala, Taluka - Savli, Vadodara - 391520 E-mail: tushar.lakhmapurkar@dicabs.com | www.dicabs.com | CIN:L31300GJ1992PLC018198

> NIDHI GRANITES LIMITED CIN No. L51900MH1981PLC02567

d Office: 503, Madhu Industrial Park, Mogra Cross Road, Next to Apollo Chambers, Andheri East, Mumbai- 400069 Website: www.nidhigra EXTRACT OF AUDITED STANDALONEAND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024

| SR.    | PARTICULARS   |   | S   | tan da lone                                 |  |  |   | С   | onsolidated                                 |  |  |
|--------|---|---|---|---|--|--|---|---|---|--|--|
| NO.    | PARTICULARS   | Quarter<br>ended<br>31.03.2024<br>(Audited) | Quarter<br>ended<br>31.12.2023<br>(Unaudited) | Quarter<br>ended<br>31.03.2023<br>(Audited) | Year<br>Ended<br>31.03.2024<br>(Audited) | Year<br>Ended<br>31.03.2023<br>(Audited) | Quarter<br>ended<br>31.03.2024<br>(Audited) | Quarter<br>ended<br>31.12.2023<br>(Unaudited) | Quarter<br>ended<br>31.03.2023<br>(Audited) | Year<br>Ended<br>31.03.2024<br>(Audited) | Year<br>Ended<br>31.03.2024<br>(Audited) |
| 1      | Total income from operations (net)<br>Net Profit / (Loss) for the period                          | 43.68                                       | 0.00  | 31.95                                       | 53.90                                    | 53.79                                    | 1,164.73                                    | 1,076.84                                      | 603.25                                      | 3,908.86                                 | 2,567.59                                 |
| 3      | (before Tax, Exceptional and/or<br>Extraordinary items)<br>Net Profit / (Loss) for the period     | 10.54                                       | (2.29)  | 1.57  | 6.32                                     | 14.67                                    | 16.38                                       | 60.00   | 12.62                                       | 95.57                                    | 63.29                                    |
| 4      | before tax (after Exceptional and/or Extraordinary items)   | 10.54                                       | (2.29)  | 1.57  | 6.32                                     | 14.67                                    | 16.38                                       | 60.00   | 12.62                                       | 95.57                                    | 63.29                                    |
|        | Net Profit / (Loss) for the period<br>after tax (after Exceptional and/or<br>Extraordinary items) | 8.32  | (2.29)  | (2.12)                                      | 3.04                                     | 10.98                                    | 9.45  | 44.94   | 3.66  | 68.45                                    | 43.69                                    |
| 5      | Total comprehensive income for<br>the period (after tax)  | 8.32  | (2.29)  | (2.12)                                      | 3.04                                     | 10.98                                    | 8.99  | 44.94   | 3.66  | 67.99                                    | 43.69                                    |
| 6<br>7 | Equity Share Capital<br>Reserves (excluding Revaluation   | 400.00                                      | 400.00  | 265.22                                      | 400.00                                   | 265.22                                   | 400.00                                      | 400.00  | 265.22                                      | 400.00                                   | 265.22                                   |
| 7      | Reserve as shown in the<br>Balance Sheet of previous year)<br>Earnings Per Share of Rs.10         | -   | -   | -   | 760.73                                   | 502.11                                   | -   | -   | -   | 896.02                                   | 572.27                                   |
|        | Each (before extraordinary items) Basic : Diluted:  | 0.21<br>0.21                                | (0.06)<br>(0.06)                              | (0.12)<br>(0.12)                            | 0.09<br>0.09                             | 1.04<br>1.04                             | 0.22<br>0.22                                | 1.12<br>1.12                                  | 0.20<br>0.20                                | 1.95<br>1.95                             | 4.15<br>4.15                             |
| 8      | Earnings Per Share of Rs.10<br>Each (after extraordinary items)                                   |   |   |   |  |  |   |   |   |  |  |
|        | Basic :<br>Diluted:   | 0.21<br>0.21                                | (0.06)<br>(0.06)                              | (0.12)<br>(0.12)                            | 0.09<br>0.09                             | 1.04<br>1.04                             | 0.22<br>0.22                                | 1.12<br>1.12                                  | 0.20<br>0.20                                | 1.95<br>1.95                             | 4.15<br>4.15                             |

The aforementioned results have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 28th May, 2024
The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure
Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (URL of the

ForNidhi Granites Limited Darpan Shah Managing Director DIN: 07650896

Place:Mumbai Date: 28th May, 2024

> Call For Entries

HONOURING THE FINEST DISTRICT MAGISTRATES IN INDIA







### **AWARD CATEGORIES**

Innovative Education | Healthcare | Swachhata Gender & Inclusion | Social Welfare | Agriculture E - Governance | Skill Development | MSMEs Start-up & Innovations | Sustainability | Water | Energy **Resource utilisation from Central & State Schemes** 

### **JURY AWARDS**

Disaster Management | Law & Order | Public Amenities Jury Special

scan to apply



eigawards.indianexpress.com



Adfactors 109